

અગાઉ લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના ૧૨ વધુ ગુનાઓમાં પકડાઇ ચુકેલ અને ચીખલી પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના ગુનામાં ૫ વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી પાડતી, સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં કાઇમ બ્રાંચના પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારીનાઓ તેમની ટીમના માણસો સાથે વાહન ચોરી, ઘરફોડ ચોરી, અને નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્ક-આઉટમાં હતા તે દરમ્યાન હે.કો. ચંદ્રપ્રકાશ ગણેશપ્રસાદ અને પો.કો. મેહુલ પુનમચંદ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ચીખલી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૮૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી નામે-મધુસીંગ ઉર્ફે અમરસીંગ ડ/૦ તેજાસીંગ ટાંક (સીકલીગર) ઉ.વ.૫૮ રહે. ઇ/૧૨, રૂમ નં. ૫, ભેસ્તાન આવાસ, ડીડોલી, સુરત શહેરનાઓને આજરોજ તા.૧૯/૦૮/૨૦૧૯ ના રોજ પકડી પાડી મજકુર આરોપીએ સહ-આરોપીઓ પોતાના ઠિકરા આઝાદસીંગ તથા હરજીતસીંગ અમરસીંગ ભાદા, બબલુસીંગ ગોપાલસીંગ, છત્તરસીંગ ઉત્તમસીંગ ભૌડ (સીકલીગર), અનીલસીંગ દયાસીંગ ભૌડ સાથે મળીને સને ૨૦૧૪ના વર્ષમાં ચીખલી પો.સ્ટે. જી.નવસારીની હદમાં મોજે ખૂંદ વાંસદા જતા રોડ ઉપર એક શોપીંગ સેન્ટરમાં મોટર રીપેરીંગની દુકાનમાંથી રાત્રીના સમય દરમ્યાન દુકાનનું શટલ ઉંચુ કરી જુદી-જુદી કંપનીની ઇલેક્ટ્રીક મોટરો નંગ-૨૧ અને ઇલેક્ટ્રીક થ્રી ફેઝના વાયર મળી કુલ કિં.રૂ.૧,૯૮,૫૦૦/- ના મત્તાની ચોરી કરેલ હતી. જે ગુન્હામાં મજકુર આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો-ફરતો હતો.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ :- મજકુર આરોપી અગાઉ સને ૧૯૯૫ માં અંકલેશ્વર જી.આઇ.ડી.સી., નવસારી, વલસાડ, વાપી, ગણદેવી, ચીખલી પોલીસ સ્ટેશનમાં ધાડ અને લુંટના ગુન્હાઓમાં પકડાયેલ છે. જેમાં ભરૂચ અને નવસારી જેલમાં પાંચ વર્ષ જેલમાં રહેલ હતા. ત્યારબાદ સને ૨૦૦૮ માં અમરોલી પો.સ્ટે. માં લુંટના ગુનામાં અને પાંડેસરા પો.સ્ટે. માં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો. તેમાં સુરત સબજેલમાં બે વર્ષ જેલમાં રહેલ છે. ત્યારબાદ સને ૨૦૧૩ માં કામરેજ, કડોદરામાં લોખંડની પ્લેટ ચોરીના ગુનામાં પકડાયેલ હતો અને નવસારીમાં મોટર ચોરીના ગુનામાં પકડાયેલ હોય તે સમયે સુરત સબજેલ અને નવસારી જેલમાં ત્રણ મહીના જેલમાં રહેલ હતો. આમ મજકુર આરોપી ધાડ-લુંટ અને ઘરફોડ ચોરીઓ કરવાનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.